

DCR વિશે

ન્યુ જર્સી ડિવિઝન ઓન સિવિલ રાઈટ્સ (The New Jersey Division on Civil Rights, DCR) એ રાજ્ય એજન્સી છે જે ન્યુ જર્સીના નાગરિક અધિકાર કાયદા લાગુ કરવા માટે ચાર્જ સંભાળે છે, જેમાં ન્યુ જર્સી લો અગેસ્ટ ડિસ્ક્રિમિનેશન (New Jersey Law Against Discrimination, LAD) અને ન્યુ જર્સી ફેમિલી લીવ એક્ટ (New Jersey Family Leave Act, NJFLA) નો સમાવેશ થાય છે. DCR નું ધ્યેય ન્યુ જર્સીના લોકોને રોજગાર, આવાસો અને જાહેર સવલતોમાં ભેદભાવ અને પૂર્વગ્રહ આધારિત પજવાણીથી રક્ષણ કરવાનું છે.

LAD વાસ્તવિક અથવા કથિત જાતિ, ધર્મ, રાષ્ટ્રીય મૂળ, લિંગ, જાતીય અભિગમ, લિંગ ઓળખ અથવા અભિવ્યક્તિ, વિકલાંગતા અને અન્ય સુરક્ષિત લાક્ષણિકતાઓ પર આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરે છે.

આ કાયદો રોજગાર, આવાસો અને જાહેર સવલતોની જગ્યાઓ (લોકો માટે ખુલ્લા સ્થળો, જેમ કે વ્યવસાયો, રેસ્ટોરન્ટ, શાળાઓ, ઉનાળાની શિબિર, તબીબી પ્રદાતાઓ, સરકારી ઓફિસો અને એજન્સીઓ વગેરે સહિત) પર લાગુ પડે છે.

ફરિયાદ કેવી રીતે નોંધાવવી

- 1 DCR માં ફરિયાદ નોંધાવવા માટે, તમારે પહેલા ઈન્ટેક ફોર્મ સબમિટ કરવું આવશ્યક છે. તમે ઈન્ટેક ફોર્મ આ રીતે સબમિટ કરી શકો છો:
 - ▶ ઓનલાઈન ખાતું બનાવીને અને NJ બાયસ ઈન્વેસ્ટિગેશન એક્સેસ સિસ્ટમ (NJBIAS) નો ઉપયોગ કરીને
 - ▶ 1.866.NJDCR4U પર કોલ કરીને અને DCR રિસેપ્શનિસ્ટને NJ બાયસ ઈન્વેસ્ટિગેશન એક્સેસ સિસ્ટમ (NJBIAS) પર ફોર્મ ભરવામાં તમારી સહાય કરવાનું કહીને
- 2 DCR તપાસકર્તા તમારી ફરિયાદ અંગે DCR અધિકારક્ષેત્ર ધરાવે છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે ઈન્ટેક ઈન્ટરવ્યૂ લેવા માટે તમારો સંપર્ક કરશે (દા.ત. તમે જે LAD ના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છો તે છેલ્લાં 180 દિવસમાં બન્યું છે કે કેમ અને શું તેઓ મદદ કરી શકે છે કે નહીં).
 - ▶ જો એવું હશે તો, DCR તમારા હસ્તાક્ષર માટે ચકાસાયેલ ફરિયાદ ફોર્મ તૈયાર કરશે. એકવાર તમે ચકાસાયેલ ફરિયાદ પર હસ્તાક્ષર કરી લો, પછી તમને ફરિયાદી તરીકે ઓળખવામાં આવે છે.
- 3 DCR પ્રતિસાદકર્તા-પક્ષ કે જેણે તમારા નાગરિક અધિકારનું ઉલ્લંઘન કર્યું છે તેના પર તમારી ફરિયાદ મોકલશે. પ્રતિસાદકર્તાને તેમની ઘટનાના સંસ્કરણ સાથે પ્રતિક્રિયા આપવાની તક છે
- 4 DCR પછી તપાસ હાથ ધરે છે, જેમાં આ શામેલ હોઈ શકે છે:
 - ▶ તમારી સાથે પ્રતિસાદકર્તા સાથે અને સાક્ષીઓ સાથે ઈન્ટરવ્યૂ
 - ▶ સંબંધિત દસ્તાવેજો, ફોટા, વિડિઓ રેકોર્ડિંગ્સની સમીક્ષા
 - ▶ તે મહત્વપૂર્ણ છે કે જ્યાં સુધી તમારો કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે લખાણ અને ઈમેઈલ સંદેશા જેવા ઈલેક્ટ્રોનિક સંગ્રહિત પુરાવા સહિત તમામ સંબંધિત પુરાવા સાચવો.

તપાસના અંતે, DCR નક્કી કરશે કે કાયદાનું ઉલ્લંઘન થયું હોવાનું માનવા માટે સંભવિત કારણ છે કે કેમ.

વિવાદનું નિરાકરણ

DCR પરસ્પર સંમત શરતો પર ફરિયાદના નિરાકરણની ઈચ્છા ધરાવતા પક્ષોને નિ:શુલ્ક વિવાદ નિવારણ સેવાઓ પણ આપે છે. ફરિયાદ અથવા તપાસ પ્રક્રિયા દરમિયાન કોઈપણ સમયે સ્વૈચ્છિક નિરાકરણની વાટાઘાટો કરી શકાય છે.

